

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમમાં પાંચ નવા સભ્યો સમાવવામાં આવ્યા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 13, 2021) – દર વર્ષે, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ (BSHF) બ્રેમ્પટનમાં સ્પોર્ટ (રમત) વિકસાવવા ઉત્કૃષ્ટ ક્ષણો આપનાર લોકોની ઉપલબ્ધિઓને ઉજવે છે. વર્ષ 2021 માં, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ સ્પોર્ટમાં ઉત્કૃષ્ટતા બદલ પાંચ નવા સભ્યોને આવકારે છે.

**ઓર્લાન્ડો બોવેન (Orlando Bowen)** ને ફૂટબોલમાં પોતાની સફળતા માટે એથલીટ શ્રેણી હેઠળ સમાવવામાં આવશે. બ્રેમ્પટનમાં ઉછેર દરમિયાન ઘણી રમતોમાં એક સ્ટાર રમતવીર, બોવેને NCAA માં રમવા માટે ફૂટબોલ સ્કોલરશિપ જીતી અને કેનેડિયન ફૂટબોલ લીગમાં વ્યવસાયિક ધોરણે રમ્યો.

**કેનેથ કાન્ડી (Kenneth Condie)** ને હોર્સશૂઝ રમતમાં પોતાના સમર્પણ માટે બિલ્ડર શ્રેણીમાં સમાવવામાં આવશે. કાન્ડી બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમમાં પ્રવેશ મેળવનાર હોર્સશૂ ડિસિપ્લિનના પ્રથમ સભ્ય છે. તેઓ બ્રેમ્પટન મેન્સ ક્લબમાં 1994 માં જોડાયા ત્યારથી ક્લબના ચાલક બળ રહ્યાં છે અને 1997 માં તેમની નિમણૂક કમિટીમાં કરવામાં આવી હતી.

**ટિમોથી ટ્રિમ્પર (Timothy Trimper)** ને બ્રેમ્પટનમાં હોકીને પોતાના સમર્પણ માટે એથલીટ શ્રેણી હેઠળ સમાવવામાં આવશે. ટ્રિમ્પરે બ્રેમ્પટન માર્શનર હોકી એસોસિએશન (BMHA) માટે ઈતિહાસ ત્યારે રચ્યો જ્યારે તેઓ સંસ્થા તરફથી NHL માં જોડાનાર પ્રથમ રમતવીર બન્યા, તેમણે 1979 માં શિકાગો બ્લેકહોક્સમાં ધમાકેદાર પ્રવેશ મેળવ્યો.

**ઝેની લિપિન્સ્કી (Zeny Lipinski)** લેકોઝ રમતને ક્ષણો આપવા માટે પીઠ (વેટરન) શ્રેણી હેઠળ સમાવવામાં આવશે. લિપિન્સ્કીએ રમત રમવાથી માંડીને એકિઝક્યુટિવ બનવા સુધી, લેકોઝના બધાં પહેલુઓમાં ક્ષણો આપ્યો છે.

**રોબર્ટ સેન્ડરસન (Robert Sanderson)** ને લેકોઝને સમર્પણ માટે બિલ્ડર શ્રેણી હેઠળ સમાવવામાં આવશે. સેન્ડરસન બ્રેમ્પટન એક્સેલ્સિઅર્સ સાથે 1969 માં સામેલ થયા. તેમણે મેજર એક્સેલ્સિઅર્સનું સંચાલન કર્યું છે, અને કેનેડિયન બોક્સ લેકોઝ ટીમનું જ્યાં તેઓએ તેમના સંચાલન હેઠળ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયામાં વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ અને તેઓના સભ્યો વિશે વધુ માહિતી મેળવવા, વેબસાઈટ [www.brampton.ca/bshf](http://www.brampton.ca/bshf) જુઓ.

બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમની સ્થાપના વર્ષ 1979 માં સીટી ઓફ બ્રેમ્પટન સાથે રમતો માટે ઉન્સાહિતોના એક સમર્પિત સમૂહ દ્વારા સંયુક્તપણે કરવામાં આવી હતી. તે 7575 કેનેડી રોડ - દક્ષિણ (Kennedy Road South) પર સીએએ સેન્ટરમાં (CAA Centre) સ્થિત છે.

**2022 માટે નામાંકનો (નોમિનેશન્સ)**

શું તમે આપણાં શહેરમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર કોઈ ચોક્કસ વ્યક્તિથી માહિતગાર છો? [વર્ષ 2022 માટેનું નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરો!](#) નામાંકનો જૂન 15, 2021 સુધી સ્વીકારવામાં આવશે.

**અવતરણો (ક્વોટ્સ):**

“વર્ષ 2021 માં બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં પ્રવેશનાર સૌને અભિનંદન! બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ બ્રેમ્પટનમાં સ્પોર્ટમાં ઇતિહાસ બનાવનાર અને આપણાં સમુદાયમાં સ્પોર્ટમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર અને ઉપલબ્ધિઓ મેળવનાર સૌનું સન્માન કરે છે. આ વર્ષે પ્રવેશ મેળવનારાઓએ પોતાના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, અને બ્રેમ્પટનમાં સ્પોર્ટને આગળ લઈ ગયા છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“આ વર્ષે બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં પ્રવેશ મેળવનાર સભ્યોની ઘોષણા કરવામાં અમે રોમાંચ અનુભવીએ છીએ! આ પાંચ પ્રતિષ્ઠિત સભ્યોએ પોતાને અગ્રણીઓ તરીકે દરરોજ સાબિત કરીને, આપણાં સમુદાયમાં સ્પોર્ટને મોટો ફાળો આપ્યો છે. અમે તેઓની ઉપલબ્ધિઓને ઓળખ આપીએ છીએ અને 2022 માટેના નામાંકનોને પ્રોત્સાહિત કરીએ છીએ.”

- *જેફ બોવમેન (Jeff Bowman), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; સભ્ય, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન*

“2021 બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં પ્રવેશ મેળવનાર સભ્યોએ પોતાની સ્પોર્ટ્સ કારકિર્દીઓ મારફતે બ્રેમ્પટનને સન્માન અપાવ્યું છે. અમે તમામ સ્તરે કામગીરી અને ક્ષમતા દર્શાવનાર લોકોના 2022 માટેના નામાંકનો આવકારીએ છીએ. બ્રેમ્પટનમાં ઉત્કૃષ્ટ એથલીટ્સ, બિલ્ડર્સ, વેટરન્સ (પીઠ લોકો), અને ટીમોને ઓળખ મળવી જોઈએ – આવી ચોક્કસ વ્યક્તિનું નામાંકન આજે જ કરો.”

- *ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સભ્ય, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન*

“પ્રવર્તમાન મહામારીને લીધે 2020 અને 2021 માટે સભ્યોનો સમાવેશ સમારોહ મુલતવી રહ્યો છે ત્યારે, દરેક વ્યક્તિ આ સભ્યોને પોતાના અભિનંદન પાઠવે તે માટે હું દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરું છું. 2022 માટે નવા સભ્યો પર વિચાર કરવા નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરો.”

- *ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)